https://archive.org/details/bk1262/page/n0/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library



realpatidar.com

https://archive.org/details/bk1262/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1262/page/n2/mode/1up

realpatidar.com


realpatidar.com
realpatidar.com

https://archive.org/details/bk1262/page/n4/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

ૐ શ્રી નિષ્કલંક નારાયણાય નમઃ

- આઠિયા સતપંથ -

-: દુઆ મંત્રો :-

લેખક :-

શ્રી કાકાસાહેબ હરગોવિંદભાઈ
લાલભાઈ (મું-પીરાણા)

પ્રયોજક :-

શ્રી- બાબુભાઈ ઝવેરભાઈ (સણકુઈ)

પ્રકાશક :-

શ્રી. વિઠ્ઠલભાઈ પુરુષોત્તમદાસ પટેલ
(ઉંદેલ)

(સર્વ હક્ક પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે)

અર્પણ રૂપે પોથનું કિંમત - રૂા. ૨/-

realpatidar.com

realpatidar.com

અનુક્રમણિકા

ક્રમ.	વિગત.
૧.	સૂવાની દવા.
૨.	ઉઠવાની દવા.
૩.	પેશાબની દવા.
૪.	જંગલ જવાની દવા.
૫.	હાથપગ ધોવાની દવા.
૬.	દાતણ માગવાની દવા
૭.	દાતણ કરવાની દવા
૮.	ગુસલ નહાવાની દવા
૯.	શેતાનભાજની દવા
૧૦.	નહાવાની દવા
૧૧.	ભાણા કરવાની દવા
૧૨.	ભાણાના જાપમંત્ર.
૧૩	ભાણા કરીને ઉઠવાની દવા.
૧૪.	દીવો કરવાની દવા
૧૫.	છડો કરવાની દવા

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n6/mode/1up

realpatidar.com

૧૬. પાથરણું પાથરવાની દવા.

૧૭. થાળો બેસવાની દવા.

૧૮. પાલખ ઢોળવાની દવા

૧૯. છાંટની દવા

૨૦. મહેર માગવાની દવા.

૨૧. બાધાભણીની દવા

૨૨. ઉકાસણુની દવા.

૨૩. જમવાની દવા.

૨૪. જમીને ઉઠવાની દવા

૨૫. છાપ કરવાની દવા.

૨૬. મેળો લેવા જવાની દવા

૨૭. મેળો લેવાની દવા.

૨૮. મેળો લઈ પગે લાગવાની દવા.

૨૯. દીવાને રજા કરવાની દવા.

૩૦. સૂર્ય દર્શનની દવા

૩૧. ચંદ્ર દર્શનની દવા

૩૨. જળ જગાડવાની દવા.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n7/mode/1up

realpatidar.com

૩૩. ઝાડ નીચે બેસવાની દુવા.

૩૪. ગામ જવાની દુવા.

૩૫. નદી છાંડી આમાસવાની દુવા.

૩૬. ફાતીયાની દુવા.

૩૭. છીંકની દુવા.

૩૮. પાંચેતન સમજુતિ.

૩૯. નવેતન સમજુતિ

૪૦. માળા ફેરવાની વિગત.

૪૧. દેવપુંજની માળાની વિગત

૪૨. મેળો લેવાનું ફેલ.

૪૩. ક્રિયા આચારના નિયમો.

૪૪. આરતી - ૧.

૪૫. આરતી - ૨.

૪૬. ફેલ.

૪૭. પ્રભાતીયું - ૧.

૪૮. પ્રભાતીયું - ૨.

૪૯. આગમવાણી —ના— .

realpatidar.com

realpatidar.com

શ્રી સમાચાર સહદેવ વાચા -
- દવાઓ -

(૧) સુવાની દવા:- આલી મેંદી.
આલે ઈમાંમ- આલ ફીરસ્તાનેં
આલ અલાહ:(કલમો) હુકુલાહ
વાહુ દલીલનાહું મહમદ મેંદી
આલી સલામ-

(૨) ઉઠવાની દવા:- અલીફુ પંજ.
સતગુરકુરી વાચા- ઈમાંન સાથે
તો ખરા સાચા-(કલમો)

(૩) પેસાબ કરવાની દવા:- ધરતી
તાબા- પેસાબ તાબા-તાબા(કલમો)

(૪) જંગલ જવાની દવા:- ઉઠો દેવ-
ઉઠો ભૂત- ઉઠો ભૂતપલીતાના- ઉઠ
ફરમ ધરતી દીઠી- ત્યાં બેસી મળ-
મૂત્ર કીજે- તોબા અલિકુંદ તોબા
તોબા-(કલમો) પેસાબની દવા બોલવી.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n9/mode/1up

realpatidar.com

(૫) ડુંગર પર ચડવાની દુઆ :- નબીતન
નબીટી- જીવ અલ્લાહ હુરીબ-દીનસાબ.
સલામદીન- હીમાંમ, હીમાંમ. (કલમો)

(૬) દાતણ ભાંગવાની દુઆ :- રહેમ
અરશે - ઝુલ્ફા અરશે - અરશે કુમતલીલ.
ઉસ્માની બેઠા હીંદ અરશે - દાતણ
સાચો પરવરદગાર નવરથી (કલમો)

(૭) દાતણ કરવાની દુઆ :- સાહીબ
સાહીબ શાહ રહેમાનબાબા - બાહુ કલમા
તારે ઉઘાડે અનુકરુ તાલા. (કલમો)

(૮) ગુસલ કરવાની દુઆ :- નબીતન
નુર - અબીતાર ગુસલ - મુમન ગુસલ-
અલ્લાહુ ગુસલ - જીનવાલી ગુસલ-
સાતીસે હુકુ - સાહેબ સહી તન-
તારો તન - નીલબંધ - શરીઅતન -
હીદા ગુનેગાર - તમારા નામથી
હીંદ પાક - (કલમો).

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n10/mode/1up

realpatidar.com

(९) सेतान बाजु (देवशत्रु दोष) पाद

તેની દવા:- ત્વચિતાન ગુરૂ-ગુરૂકા
સૈતાન-દેખી ગુમાનકી દવા.
ઉતારવી. કલમો)

(૧૦) જાદુવાની દવા:- જેસી મીઠુરી ધંગલ
કી- સોરી મંદૂરી ભાબાકી. જેસા પાહુ
દિસતિકા. સેસા પાહુ ફેંકા. જેસી
આંખ આબાસકી. સોસી આંખ પાંચ
ઈકીકી- સાગનસે પાહુ ગજબ કરી
ફેમસે પાહુરે નાહુવો- ચાલી દેવુ
કીડે પાડ- અંતર ફુંકયા ધોરીએ રાહુ.
અંતરમાં ફેલ- અંતરમાં મેલ- મેલ
ફુ મારો. આવ્યો ઉપવિદળો આરો.
(કલમો-)

(૧૧) આગલા કુરવા દિસઅવતારની દવા:-
મછ- કછ- વારાહ- નરસિંહ- વામન
પરશુરામ- રામ- ક્રિષ્ણ- બુદ્ધ- નકલંકી
નારાયણ- ઈમામ કુરાન.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n11/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

જમાલ નૂરાલ- જલાલ ઝાહેદ- ઉલીકો

ફાતમા- હુજરતશાહનુ મુરતુજાઅલિ-

પંજેતન પાક- નૂર બરાબર મહુમદ-

આગા અમાન- અગાર દિયાન- આજાદી

ઝડસઠ તીરથ સ્નાન- જે મન ચંત

એક કરીસે- તો ઝામરાપુરમાં ફૂરા

ફેરીસે- (ઝમરસરકી આબાદી લીલીયા

ભેદ- અજીયાર આગા કરી બેસો

હવે- પાપદૂરકીને દરસ આગા કરજો

(કલમો) -

(૧૨) જાપમંત્ર :- ૧. આલીઅલ્લા ફજલ

કરો- ૨. સુભાન અલ્લા ફતેહ કરો-

(નાસ્તીને જપવો) ૩. પંજેતન કુદરત

નુ આસન કરો- આવી બલા દૂર

કરો- આદ અંતના બંદાનું ભલું

કરો- ૪- કરીમા કરીમ કરો-

રહેમાન રહીમ કરો- આવી બલા

દૂર કરો- આદ અંતના બંદાનું ભલું

કરો-

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n12/mode/1up

realpatidar.com

૫. અલ્લાહ અલી મુશ્કલાતુ મારી
આસાન કરો. આલી બલા દૂર
કરો. ૬. ઈસા અલી ફૂજલ કરો.
આલી બલા દૂર કરો આદિ અંત
ના ઊંદાનું ભલુ કરો. ૭ દરૂદ :-
અલ્લા હુ મૌસરીઆલા - સૌયદના
વલી અલા - સૌયદના મહમદદીન-
મુબારક - નુર અલી - ૮. નાદેઅલી:
નાદેઅલી - મુજમજ હુરલ - આજાયબ -
તજીદહુ - ઓનાલકે - ફીન વાહીલ - કુલ
હુમગીન - વ ગમગીન - સૌયનઝલી -
બે નબુવતકે - ઈસા મહમદ - વ બે
વિલાયતકે - ઈસા અલી - ઈસા રાલી
ઈસારાલી - ૯ - તોબા નકુસર
માફ કરો - ૧૦ - કલમો : હુકલાયલ
લાહુ - ઈલીલાહુ - મહમદમેંદી અલી
અલ્લાહ -

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n13/mode/1up

realpatidar.com

૯૩. માળા ફેરીને ઉઠવાની દવા:- અલા
હી· નૂરમહમદ મુબ કબુલ- હજરત
શાહ- મુરતુજાઅલી· તમારી દુઆ
બંદગી થઈ તે દરશ દરગે કબુલ
કરો- સમરણાકુ તારો- ત્યારૂ કરો
સત્સંતકુ તારો- દુર્મતિકુ દૂર કરો.
કલાલ આબરનાં બંદાકું ભલુ કરો.
આશાસીનો ફેરો ટાળો- સમરાપુર
માં વાસ આપો. (કલમો).

૯૪- દીવો કરવાની દવા:- વાસુદેવ
વંદે- સર્વ કોઈ દીવો- દેહી જાય
પાપ- ઓહી દીવો આપોઆપ-(કલમો)

૯૫- છડા કરવાની દવા:- પરથમ
સવર્ગ જમી ધરતી- તે ઉપર કીધા
સુષ્ટિકી ધાતા- શ્રી સમરિરજાથે
આપ નીરંજન ધરી. (કલમો)

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n14/mode/1up

realpatidar.com

૨૬. પાણેતરનું પાથરવાની દવાઃ- દીન
આગે- નો કાફર ભાગે- (કલમો)
૨૭. થાળી ઉભરવાની દવાઃ- આદલી
હિન્દુ કીજે પાક- થાળે ઉભવા આધાતે
આલમ- અલી મુરતજા પુરે ભાગ- હાથ
દસ્તીકા મન હુંવે પાક- સૌ દેવ તેને
સુધે જમે- પાક હોઈ સતપંથમાં
રમે- પહેલા કીજે મન- સતગોરને
સોંપીને આવો તન- ઉપદેશમાં
સતગરસેને દવા ભેજ્યા- આદ દેવ
ને જોઈએ તમારે સદકા કીયા- (કલમો)
૨૮. પાવડા ઘોળવાની દવાઃ- ૐ નમઃ
શ્રી નકલંકી નારાયણ- અલખ ની-
રંજન પિતાંબર- પિતાંબર કેશવા-
અહમદ દીન- આદ્યુવદીન- ગરુડ દેવ
નારાયણ વિષ્ણુ દેવતા- ઓમકાર
મધે છત્રીસ જુગ- ચોરાસી ચોકડી-

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n15/mode/1up

realpatidar.com

પરમાત્મા તે વસ મધે રાખેલી છું-
સાદ લેહરી અલીની ફરમાન મહુંમો
ત્રીલોક આરાધતે - નત નત દરશન-
દરબાર દરશન - સતપંથમાં જાણીએ-
ચાર કલમા વરતી લે- ચાર જુગ
થાપી લે- અનંત જુગ નિસ્તારી લે-
પ્રેમ પદ પાઈ લે- દીદાર એટી લે-
શ્રી ઈસ્લામશાહના દાતાર- પ્રેમ
પાઈ લે -પાંચા વંદતે- (કલમો)
પાવન બનાવનારૂ સાદરની દયા
તરીકતની- મુબીનો આગની દવા
શરીઅતની અને (મઝુરની) આસ્માંનોઈ:-
ચાર દીશાએ છાંટ નાખ્યા પછી
દીવાને છાંટ નાખો એટલે દેવમાં
લોક તેમને પગ લાગી ઉભા થવું
અને ઓત થઈ આતા કરવી- વાની
ઉલાવાઝને કમાડ જ્યારે બે હાથ .

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n16/mode/1up

realpatidar.com

જોડીને બોલવું કે:-" ઉકરસા સા-
હેબ-ગરીબ નવાજ-મદદ કરો
મહારાજ-ફાત્રી કાશી દાતારીશા-
ની-દસ દસ્તો કબુલ કરો. તમારી
દુવા તમે કરો." બોલવું ને ઉભા
ઉભા માળા ફેરવી-

૧૯. ચાંટ લેવાની તથા બાંધવાની દુવા:-
ફાતીંગાની ચાટી રાખો-મહુદમ
ના માર રાખો-પરસલાની ચાકી
રાખો. દંજાની આંચ બુરાય કરો.
ગંદા નકુંચ કરો. (કુલમો)

૨૦. મદદ માગવાની દુવા:- ઉકરસા
સાહેબ-ગરીબ નવાજ-મદદ કરો
મહારાજ-ફાતીગાની ચાંટી રાખો.
મહુદનના માર રાખો. પુનસરાદ-
(પરસલા)ની ચાંટી રાખો-દંજાર
ની આંચ બુરાય કરો. ગંદા નકુંચને

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n17/mode/1up

realpatidar.com

તમારે સઘળું સારો - સદ્બુદ્ધિ
આપો. કુબુદ્ધિ ટાળો. નવખંડ લીલા
લહેર કરો - ધર્મ ભંડારનું ભલુ
કરો - (કલમો) દીન:- મહેર આગતી
વખતે જીની લહેર કરવાની ભુંઢ
તે મુમીન જાણવાની - અલ્લાહ કરવી -
"જે કુલ નબીને કુલ પાંજની આપની
તે બધી દીન દુનિયાનું ભલુ કરો -
ગામમાંથી નાતજાતમાંથી દેશ
પરદેશ દુનિયામાં વિશ્વશાંતિ થાય
સર્વેનું ભલુ થાય - તેવી મહેર કરી
તમારા પુન્યની ઉગારો."
૨૧. ભાણી ઓળખવાની દુઆ:- "બાધા
ભાણી. મોટી ભાણી - ઘડાતેર ભેંસની
ભાણી - સુવાવડી ઉજીની ભાણી"
= લુકડું. પાકડું - અવજડું - આબર
ડું - કાયમડું - દાયમડું - કરમ ડું - .

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n18/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

ઘરમ હું · અબીદું · આહેર હું · મહૂર
હું · બાતનહું - હું કરે એવો ત્યારી
દરોજ હુ ભાવે - પહેલા ઉકસો -
નવા ના કરશો - ઉંદી અંધારથી -
પેટાળથી - કુલ ગુના બકસો (કલમો)
(આ દવા મહુવાર મહુંવી શાન
મહુ વચન છોર ઝારવી - પછી છોર
લેવાની દવા બોલી મહુ છોર
નાખવી - ચરણામૃત પગ લાગીને
લેવું.

૨૨. ઈકીસૈર ગાંજ ઉકારતુંની દવા:-
ઈશાશાની પરબતીંટી - મહમદ
દીન શાહુશાની - સેરહુદા - હુક
અનાસી દઈ બાબા - સાહુંકા કોટ -
લાહુકી બાટ - નવસે નવાણું નદી -
મહમદકે દુવારે વહે - કુલ બાબા
શે દઈ - સાહેબ કે સેતાન બાજુ
દૂર કરો - દમ દહુંવી - વાટ સોહલી

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n19/mode/1up

realpatidar.com

માથા ભારી ની દુવા :- પરપાક = નુરપાક = તમારે નામે
પાક = તમારા નામને પ્રસાદે બંદો પાક = ધરતી પાત =
આસમાન પાત = પવન પાક = પાણી પાત = ચાંદો પાત = સુરજ પાત
તારા મંડળ પાત = તમારા આભ પાત તમારી આભે ફુલ જમાવ પાત
બંદાન પાત = તમારા નામને પ્રસાદે બંદા પાત = ફલાણો

દમેશાહા અલહદલીલ્લાહી - રહ્યાઈલ
રસુલ - તાહીરતબુદા - હજરત કુદુલ
-સલાઅસલ્લી - રહુદરદીન નબ
ફ્રીયાદ - સલાહી - ગારદીન - તબ
રુ દલ વસે. સરચીયારા હાજર
રહે - મુમનાન દીદાર દીસો - સલા
બારકત - નવરંગી જવ સલેમાન -
ના ફ્રીયાદ તકપર કરુ - સરચીયારા
હાજર રહો - ઈસા પાક પરવર
દીગાર - નુર મહમદશાહા - શાહ -
અલી - શેર ખુદા જીનકુ પીર
પાલા - તનફા જવ પાસે રહું રહે -
અમરાપુર હુકમ પહોંચાડુ - મોટા
ગુરુ દીયા - જમાતોની આગતમાં
આવો - તમારો દીદાર દીસો - મોરાસી
ના ફેરા ટાળો. (ફલાણો) ના દવા
મહુવાર બોલવી -

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n20/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

૨૩. જમવાની દુઆ:- બાલેઈલ હૈયે-
ઉદેદ બેહાવે - આદિત આવે - વેલા ક-
વેળા - કલ્પી કોરી ખાવા તેરીખ
બેરાડી દેવતા કબુલ કરો. (૩વખત)
નોંધ- ભાણ પરસારી દુઆ ભણી જમ-
ડી "ઈરમાન" કહી જમવું-

૨૪. જમીને ઉઠવાની દુઆ:- અલહીને
દીધા - ઉદેને ખાવા - ખાવા પીવા
પાક કીધા - બારે માણે તેર માણે-
વાલ્લહ માણે - ઈરમાન માણ - ઉદેણી
ઉદેણી કબુલ કરો. પાપ દૂર કરો
સતપંથના ભેળ બેડો કરો - દમ
દાલુબદિ - વાર સેલૈરી. દમેશલાલ
મુરકુમરઅલી - કુદ ઉપલાની દાણો
અલી - (૩વખત) - નોંધ:- ભાણ પરસારી
આશીર્વાદ આપવો આણે નહીં પ-
માણો બોલવું - "જે ભંડારથી રોજી

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n21/mode/1up

realpatidar.com

આવી હોય તે ભંડાર ભરપુર રાખે-
અવકવાણારનું ભલું કરે- આવનારનો
ખુલાસો કરે-

૨૫- હાથ ધુરવાની દવા:- પહેલા અંતર
ધીમે પાક- રુખાઈ દવારે આવી
હાથ- (ધુલમો) નોંધ- દરેક કપાળે
હાથ કરે ત્યારે બોલવું-

૨૬- હુજરી લીધા પછી મેળો લેવા
જવાની દવા:- હુજર પરસાદી મેળા
લેવે- મેળા લીધા પછી સન્મુખ
દીદાર દેવે- પરતાપ કરતા આપણા
દલમાં રહેવે- સર્વ દેવ પ્રતપક્ષ
દીદાર દેવે- દેવ સહુ કરી આપણુ
નિલાવતી જુએ તો આદ શાંતિ- દુઃખી
કદી ના હોવે- હાજરી મેળા લીધા
પછી દવા ભણીએ- ઉપરદે મદે
સમરથ નિરંજણ તું કરે- દામ -

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n22/mode/1up

realpatidar.com

સ્વરૂપ રૂપાએ આવે. ઉસકા દે-
દાર કરીએ. સંવત સારાક સાદ.
સરસાડ સૂદ પરમાણું - બિસ્મીલ્લ
પરે ભરી પૂરી બોલ્યા. સરઅલ
દરીયા અલાદ ઉનાદના પ્યાલ્યા-
(ફલાણો) - નોંધ - આ દવા બોલી
પાણી ભાગીને ઉપર પઈ મેવો લેવા
બાઈન ખંધે જવું.

૨૭. મેવો લેવાની નવી દવા:- હે જંદા
અલીશાહ પાયા - દીવાન ગુરુનકા
પૂર પાયા - મહમદ મૈંહીનકે ચલાયત
પાયા - પંચતન કલમેકી પાયા - મહા
ભીવન બોહુના દર્શન પાયા - (ફલાણો)

૨૮. મેવો લઈ પાણી ભાગવાની દવા:-
બિસ્મિલ્લા - અલાહુ માલકુના મ-
ષ્ટે કરે - મહેર કી નજર કરે - તમા-
રી કુદરત જાહેર કરે - અનંત -

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n23/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

કરોડીના મેળા કબુલ કરો. (કલમો)
નોંધ:- પાણી લાગી ઊભો થઈ. "પાક
નકુ આપાજીને - ગોરગતને" એમ
બોલવું - ત્યારપછી ચારુ જાપની
પાંચ આતા કરીને પછી ઉભા થઈ
રસુભાનઅલ્લાની પચ્ચીશ આતા
કરી પગે લાગવું - ત્રીજી પાંચ
એજ જાપની આતા કરી પગે લાગી
ઉભા થઈને પાંચ કરીમા કરમની
આતા કરી -(૨૨૫) નામ કલમાનાં
શરદો કરતા કરતા લેવા - આ
જાતની ક્રિયા કર્યે દિસવાર
બસનારણે - આકાશાર રૂપિયાનો
નાતરવાલ્લાહીનો ગુનો બેસે છે.

૨૯. દીવાને રજા કરવાની દવા:- ગોર
દેવ, ગોર દેવતા - ગોર વિના ઘોર
અંધારા - ગોરને એવીશે તો આમરા-
પુર વાસ - (કલમો)

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n24/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

૨૯. દીવાને રોશન કરવાની બીજી દુઆ:-

દીવાકોકા ઘીએ જળે - ફુલવાડીમાં ફૂલતા જળે. ફુલની સુગંધ લેતા જળે. દેવલોકને દવા સલામ કહેજો. નામ પૂછે તો અમારૂં નામ કહેજો - (કલમો)

૩૦. સૂરજના દર્શન કરવાની દુઆ:

રામનામને લઈલુ લાગ્યા - લહુમલુ નામે અમર પાયા - ભરતનામે ભં- ડાર પાયા - શત્રુઘ્ન નામે સત લા- ગાયા. કૃષ્ણ નામે પારાપાર ઉગ્યો સૂર - પશ્ચિમે પૂર - ઝલક મલક ઉપર કી ચોપ - મલા રિદ્ધિ સિદ્ધિ આ- પો. સૂરજ બાવા - (કલમો)

૩૧. ચંદ્રમાના દર્શન કરવાની દુઆ:-

બરકત બિસ્મિલ્લા - રહેમાન નર રહીમ - સાત સલામ - અરજ ઉમેદગાર - બંદો અરજ ઉમેદગાર.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n25/mode/1up

realpatidar.com

ધરતી આસમાન સર્વે જમાતનો
મારીફ- સ્વામી રાજા સતગુરુ-(કલમો)

32. જળ જાડવાની દુઆ:- જળ જાગે
થળ જાગે- જાગે જળકા રૂપ-
રામ લક્ષ્મણ દોનું જાગે- જાગે હનુ-
માન વીર- જળ પવિત્ર થળ પવિત્ર
તીરથ ઝુંરી સતગુરુના નામથી
જળ પાક હોઈ- (કલમો)

33. ઝાડ તળે બેસવાની દુઆ:- ઝાડે
ફિરસ્તુ- થડે બિલ્લુ- ડાળે હનુમાન-
પાંદડે પાંદડે મહેશ્વર- ઓ ઝુકુ ઝાડ
ઓ ઝુકા- (કલમો)-

34. ગામ જવાની દુઆ:- અંતર ફુરશીદ
ઝુંરી રહેમાન- તારા બેલી- તમે
ઈમાંમ પણ બેલીઆ- ભલે કદીઆ
આંબા પાદર- તળાવ કાંઠા- બેલી
ફા ફેર- બેલીકી બાઈ- ફુડ ફરે-

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n26/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

કપટ કરે- ઈન્નહુ મહમદ મેંહદીની
દુહાઈ. દમ દમ બોલો બાર બોહુલી.
સતગોર છે સલાગુ- સુકર સેતાન
ભાગુ- સતગોર પુર દુશમન મારે
સતીશમાલા સારૂ- તાગુ સુકર-
સૈતાન સાગુ (કલમો).

૩૫. નવી ઘોડી સીંગાળવાની દવા:-
ગંગાભકી મારી. કુળાસ્ફડા વાફ. મહ-
મદ રસુલીલ્લાના નામની વાંકી
પાડ- (કલમો)

૩૬. કુતરીયાની દવા:- બારકત બીબી
મીરીયમ- વીર સુલેમાન નર સલીમ
સી જબરાઈલ- નજર રુકસીર બાંધું.
નજર સાજે દવા દે- ઈમાંમ શાહ દે.
મારુફ- પાંજેતન પાક- સલાબત
સુરસાથેલ- વ જબરાઈલ પાક-
કુતરીયા છે- (કલમો)-

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n27/mode/1up

realpatidar.com

નોંધ:- આ દુઆ પાંચવાર ભણવી
અને મરાદ દરરાતી વખતે પાણી
કે શ્રીફળનું પાણી - અને ધૂપ કે અગર
ઉપર કરવી - અને પછી પાંચ કે એક
પૈસા હકિકના મૂકી મહેર માગવી -

૩૭. બીડું આપે ત્યારે દુઆ:- શુકર ઉલ
હાલિલ્લા અલહમદ આલમીન.
(ફુલમાં) -

૩૮. પાંચતન સમજુતિ:-

૧. નબીરસુલલ્લાહ - (બ્રહ્મા)
૨ ઈમામ હુસન - (શીવ)
૩. ઈમામ હુસેન (વિષ્ણુ)
૪. શાહ મુરતુજાઅલી (મહા વિષ્ણુ)
૫. બીબી ફાતમા (શક્તિ)

૩૯. નવતન સમજુતિ:- ૧. મહાવિષ્ણુ
૨. શક્તિ ૩. વિષ્ણુ ૪. લક્ષ્મીજી ૫. શિવ
૬ પાર્વતી ૭. બ્રહ્મા ૮. સાવિત્રી
[illegible]

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n28/mode/1up

realpatidar.com

૫૦. આઠાર કરવાની વિગત:-

પાંચેતનની છ પહોરની આઠાર- પંચેતન બારુ ૪

(૧) ફજરના (સવારે) ૪ આઠાર બારુ

જાપની કરવી- તેનાથી ૧૦૦૦ ફ્રતના

તથા ઓલીઆના દર્શનનો લાભ થાયછે.

(૨) બપોરે - ૧૨ આઠાર કરવી- તેના ૧૨

થી ૧૨૦૦૦ ફ્રત અને શહીદોના દર્શન

નો લાભ મળેછે.

(૩) ત્રીજા પહોરે- ૮ આઠાર કરવી. તેનાથી ૧૩

૬૦.૦૦૦ ફ્રત અને અસ્હાબકુમારોના

દર્શનનો લાભ થાય છે.

(૪) સંધ્યાકાળે- ૧૨ આઠાર કરવી. તેના ૧૨

થી ૩૨૦૦૦ ફ્રત અને પિરોમુનાં દર્શન

નો લાભ થાય છે.

(૫) સાત ઘડી રાતે- દિવસ આથમ્યા ૧૫

પછી ૧ $\frac{3}{4}$ કલાકે- ૧૭ આઠાર કરવી

તેનાથી ૩૦.૦૦૦ ફ્રત- ૧૦૦૦ ફિરીસ્તાં

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n29/mode/1up

realpatidar.com

છોડાવવાનું ફળ તથા શક્તિના દર્શન
નો લાભ થાય છે. વળી એના પોતા
આપે તો ઉંઘ વખત થાય છે. જ્યારે
જાગવું હોય ત્યારે જગાય છે.

૧૧ (૬) મહમદશાહે - ૪ માળા તથા ૨૦
માળા પાંચેતનની ફેરવી તેનાથી
૭૦,૦૦૦ ફળ, ૨૦૦૦ મોતી, મહાવિષ્ણુ
ના દર્શન - ૨૬૦ ફરસીના દર્શન
તથા અનંત તીર્થયાત્રાનો લાભ
મળે છે.

(આમ દરરોજ ૫૬ માળા જપવી
અને ૭૬ ૨૦ પાંચેતનની માળા ફેરવી-
વળી મધ્ય દરરોજ ૩૭ માળા ફેરવા
થી આધિવ્યાધિ દૂર થાય છે. અને
મધ્ય પૂંજા ન થાય તો ૩૬ માળા
ફેરવાથી પૂંજાનો લાભ મળે છે)

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n30/mode/1up

realpatidar.com

૭૧. દેવપુંજની માળા કરવાની ફરજ:-

વધેતની માળા કરી ૯૯ દેવદર્શન
ની માળા કર્યા વિનાં દર્શન ન
લેવાય. બાવાજી જમ્યાપછી ચાર
લઈને ૨૫ માળા ચાલુ જાપની
કરવી. મળાં લીધા પછી ૫ માળા
ચાલુ જાપની - ઉભા થઈ ૨૫ ને ફરી
૫ માળા કરી પગે લાગવી - કરીમા
કરમની ૫ માળા કરી - શારદા (બે
માળા) એટલે ૨૨૫ કલમાના નામ
પગે લાગીને લેવાં. વળી દરેક જાપ
ની ૫ માળા - દરૂદની - ૨૫ માળા - ના
દેશલીની ૫ માળા તથા પાંચેતનની
૨૫ માળા કરવી જોઈએ.

પ્રતને દિવસે ૩૫ શારદાની - એકે
માળાએ પગે લાગી ચાલુ જાપના
૩૫ શારદા કરવા.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n31/mode/1up

realpatidar.com

શુકવારે - ૧૨૫ નજપોરની પૂંજ પહેલાં
કરવી. પછી પૂંજ લેવી. વળી દરે
પૂંજમાં જ જમાય તો ૭૬ માળા કરવી.
દર ચોથા શુકવારે મધે પૂંજ કરવી
તથા લેવી. દર ચોથા સોમવારે ૭ માળા
નાદેઅલીની કરવી તથા ૧૨૫ નામ
નાદેઅલીના લેવા જ આવડે તો
દરૂદ બોલવી.

ઉતાવળુંમાં જુમની ૨૫ - મુરાદની
૫ - સાતરની - ૫ - ચાંદની - ૫ - સલોત
ની - ૫ એમ ૪૫ માળા કરવી.

૪૨. મેતો લેવાથી થતું ફળ:- મેતો
લેવાથી પૂરવી મહદ્રિલાનું ફળ
તથા મહકા હજ કર્યાનું ફળ મળે છે.
મેતો ન લે તો ૭૨ દિવસ ઉજરમાં
આંધળા થાય. દરરોજ સામસામી
તાજરથી સલાંફોલ કાંકુણ છે તથા.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n32/mode/1up

realpatidar.com

જમણા હાથનો અંગૂઠો નથી તેથી
ઉપાય - અને પુલસરાતની કાંટી
માં ભૂલા ન પડાય -

૪૩. દિક્ષા આચારના નિયમો:-

(૧) અગરબતી રાખી રૂ કે કપડું બાળવું.

(૨) અગરબતી ભજન કરવું.

(૩) કુરાનનો હિસ્સો ભાગ દરરોજ વાંચવો.

(૪) પારસના વ્રત - ગુરૂવાર, બીજ, ચૌદ
વાર તથા બીજાં વ્રતનો આહાર
ઉપવાસ કરવો.

દિક્ષા - આચાર.

(૧) પેશાબ વખતે માટી કે પાણી
લેવું હાથપગ ધોવા - ગાળ કોગળા
કરવા. (૨) જંગલ જાય તો માટીથી
ગુદા સાફ કરવી - હાથપગ ધોવા
ચાર કોગળા કરવા - પહેરેલ કપડાં
એ નાહવું - કોઈને અડકવું નહિ.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n33/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

(૩) નમાજીને પાંચ ફિરાના કલમા.
રૂમાલ મોટો રાખવો. કાછડી ખોસવી.
ધરતી માતાને અંગ ન દેખાડાય.
એક કાવડું ખાવે ૪૦૦ માળા પૂરે.
(૪) સંભોગ કરી નાહવા વગ મેલું પાણી
પણ ન મૂકવું. ગુસલની દવા ભણી
નહાવાની દવા ભણીને પવિત્ર થવું.
બારણા-ગોદડાને અડવું નહિ. ૧૦
માળા કરવી (૫) સૂર્ય ઉગતા પહેલાં
દાતણ કરવું ને નહાવું. (૬) દેવ
દર્શને જવું. ન જવાય તો ૭૬
માળા કરવી. ચરણામૃત ને પ્રસાદ
લેવો. મંત્ર ભણીયાવાળું શરબત બોલવું.
(૭) દરરોજ પાંચ નમાજ બોલવાં.
(૮) દરરોજ સાંજે આરતી અને દેવ
ઉતારવી. અમાવાસ્ય દિવાસાની રાત્રી
ને તેને વ્યવહાર કાઢી મેલવો.

realpatidar.com

realpatidar.com

૪૪. શ્રી સતગોર સાહેબ વાચા:-

આરતી-૧: જય જાદવરાય, જય મા-
ધવરાય, આવંતે ઉતારો ફુરમાનદ
ફરમાવન્ટ. જે થકી બ્રહ્મ ગ્યાની ભાવ.
જયદેવ. જયદેવ-૧. પ્રથમ અવતાર રૂપ
ધરીને આવ્યા સંખાસુર પાપી-માર્યા:
ચતુરાનંદે ભાંગી વેદ લિયા ને લાવ્યા.
જયદેવ. જયદેવ-૨: બીજે સૂર કચ્છ
અવતાર-ધરીને અમૃત મથવાને કાજે-
અમૃત: પીધ ઉધાર ના દાન્યો ફજંડવ
ફોરમ મહારાજને. જયદેવ. જયદેવ: ૩:
ત્રીજે વરાહ રૂપ ધરીને દૈત્ય હણતા
આવ્યા પૃથ્વીનો પાપી-માર્યો: દાઢે
ગ્રહીને પતાળ બોધ્યા-ત્યારથી
ચિંતર સારી. જયદેવ. જયદેવ: ૪:
ચોથે નરસિંહ રૂપ ધર્યું તપ કીધું
ને વર લાધો પ્રહ્લાદ રક્ષા-ક

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n35/mode/1up

realpatidar.com

નખે કરી વીડાર્યા - તમે નરસિંહરૂપ:
જયદેવ - જયદેવ :૪: પાંચમે શ્રી વામન
છલીયા - તે પકડી બલીરાજા કુંડમાં ચાંપ્યો.
વામનરૂપ ધરી માંગ્યાં પગલાં - આવીને
પાતાળે ચાંપ્યા - જયદેવ - જયદેવ :૫:
છઠે ફરસુરામે ફરસી હાથોમાં લઈને
ક્ષત્રી: સહસ્ત્રાર્જુનને મારી પૃથ્વી
નક્ષત્રી કીધી : જયદેવ - જયદેવ :૬:
સાતમે રઘુવંશી અવતાર આનંદ
ફરીઆ રાજા - આનંદ : પંચવટીમાં
પધારીયા રામ સીતાપતિ સ્વામી - જય
દેવ - જયદેવ :૭: આઠમે મથુરામાં
અવતાર ગોકુળ ગોપીનો સ્વામી : ગોકુળ:
ગાયો ગોવાળના રાખ્યા ફરતે - ગોવર્ધન
તોળી. જયદેવ - જયદેવ :૮: નવમે
બુદ્ધ તણું અવતાર - ભાર પૃથ્વી પર

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n36/mode/1up

realpatidar.com

પાદશાહ: ભાઈ: દીવાન ઢાળી બેઠા
દાસ્તુરી પદ - બીજા જુગાદિ રૂપાળા -
જુગાદિ - જુગાદિ: ૨૦૦૦ - દસ્સામે રૂપે
રૂપ નકલંકી - પૂરણી નિરંકાર રૂપ કહ્યા -
પૂરણી: અવિહલ રૂપ ધારી આદિ
રામ - રાજુલ સેવકને કહ્યા - જુગાદિ -
જુગાદિ: ૨૦૦૦: દીધ સેવકાસની સા-
રતી જે કોઈ સંતરમાં દાસદીન -
સદાઈ: અમોલક ગુરૂજીનો ભજતા -
અમરાપર તરશે - જુગાદિ જુગાદિ.

૩૪- આરતીની વિધિ:- પહેલા પહેલા
જુગમાં સોનાના પાટ - સોનાના થાળ:
સોનાની દિવાઓ સહિત બેઠા નકલંકી -
નાથ: પાંચ દાસીની આરતીઓ
ઉતરાવો - કંકુને કેસરના છાંટા
છાંટણા છંટાયા: ૧: બીજા બીજા
જુગમાં રૂપાના પાટ - રૂપાના થાળ:

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n37/mode/1up

realpatidar.com

ઉપાજે રિખિસરન જોડા નકલંકી
નાથ: વડા ઢકુલિની આરતીઓ
ઉતરાવીઓ - કંકુને કેસરના છાંટને
ચાંદલા કરાવીઆ : ૨ ॥ : ત્રીજા ત્રીજા
જુગમાં ત્રાંબાના પાટ - ત્રાંબાના પાટ-
ત્રાંબાના રિખિસરન જોડા નકલંકી
નાથ: વડા : કંકુ : ૩ ॥ : ચોથા ચોથા
જુગમાં માટીના પાટ - માટીના પાટ:
માટીને રિખિસરન જોડા નકલંકી
નાથ : વડા : કંકુ : ૪ ॥ : પાંચમા
પાંચમા જુગમાં પથરાંની પાટ-
પથરાંની પાટ . પથરાંની રિખિસરન
જોડા નકલંકી નાથ : વડા - કંકુ : ૫ ॥
જુગો જુગો પલેસ્યા આગળ રે આઈ-
આગળ રે આઈ : હીર જોડા અનુપ
શ્રી નકલંકી નાથ : વડા : કંકુ : ૬ ॥

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n38/mode/1up

realpatidar.com

૭૬. દોહા:- અલ્લાહ કુંડે વરસ્યા મોરારી
સુભાન અલ્લાહની નહિ તલ્લીનાંહી-
આપ કુંડે પીર હાજર પાવે-મકુંદ
ને પામર એવા મેલાવે-॥૧॥-નરસીં
નારાયણનું દિલકેરુ જે અલ્લાહ-મહા
ખાંડે [illegible] વસતા - ફકીર
કુંડે પીર દીદાર દીઠા - રામ સંતન-
ગતિયાની ગતિ તમે કરજો: ॥૨॥
અલ્લીશાહ સુભાનઅલ્લાહ ને-રામ
મુરતની દીવાદાંડી દીઠા : ફકીર કુંડે
પીર સત તમે પાળો - કુડીયા કેરી
ઉતારી મેલ [illegible] ॥૩॥
૭૭. શ્રી સતગોર શાહદેવ વાચા :- સત
ગોર કહે મુનીવર સાંભળો - સત
વાચા જે પાળો રે :॥૧॥: કોટિ કર્મ
તે દૂર કરો - દસુંદ વસુંદ આપોરે
:॥૨॥: ઓળખ દાન દીલ્હે લાવણું.

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n39/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

હવે પ્રભાતી દીઠો રે :૩: સત કરો
બારા તણું - જુગનાં કારજ સાધીઓ રે :
૪: દિગ્રા સામાચાર પામો પ્રેમરસ -
તારે રુપવંતા પાસો રે - ૫ - નમીનમી
નમણું કરો - મારા સામી તે ગાઈ રે :
૬: પરઠીયેથી સૌંગી વેગળા - તારે
જપ તપ ફેરાસો રે :૭: છોડી તબલ
અંદરથી કરો - ચાલ ઉતાવીળા જાશો રે -
૮: ખોટી જાશે તો ખોર સાહિબની -
તમને કુળ ફીરતાર રે :૯: સંસારની
માયા પરહરી - સામી દયાનમાં રહેજો
રે :૧૦: કૂડ ચોરીથી રહેજો વેગળા -
તારે લાજ જ રહેશે રે :૧૧: દેવ
દર્શન નીત જવું - રંગે રહી ગત ભરતા
રે :૧૨: અહંકાર સહુથી નમ્રતણુ કરો - રામ -
રટ્યું ગાજીન નો ગણીએ રે :૧૩: પા-
દરની ખટકડી જાણીએ - સુકરીત -

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n40/mode/1up

realpatidar.com

સમરણ કરીશું રે ॥૧૩॥ નિંદા પ-
વરીથી રહેજો વેગળા - રૂડું આચાર
માં ધરીશું રે ॥૧૫॥ સતસંગીના ગીત
સાંભળો - હૃદય નિર્મળ કરીશું રે ॥
૧૬॥ કામ ક્રોધ મદ ત્યજીએ - તેથી
જપતપ લાગશે રે ॥૧૭॥ લોભ લાલુતા
ને વારીશું - ત્યારે ગુણવંતા થાશો
રે ॥૧૮॥ બોલ્યા સતગુર બાવા
બોટડી - બાળકુશળ નર નારી રે ॥
૧૯॥ વચન પ્રમાણે જે ચાલશે -
તેમનો વૈકુંઠમાં વાસ રે ॥૨૦॥

૭૮- શ્રી સતગુર સાહેબ વાણી =
પ્રભાતિયું = રૂડો મુનીવર સાથી
વાતો વખત વેળા શું સૂતા તો.
હવે વખતે દળદર દૂર કરો રે ॥૧॥
રાત ચાર ઘડી રહે જ્યારે - ત્યારે
- ઉંઘ આવે તો સ્મરણા કરજો -

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n41/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

ભરી લાવતા રે :૨।। : જેના સ્વામી
સમરણ કરતા. તેને દુઃખ ન
આવતો. હેત કરીને તે ઘર હો.
જાતા રે :૩।। : દુઃખ ભરીને
આશીષ દેતા - વૈકુંઠ વસેલા
આવો તો. તમારી કમાઈના ફળ
ભોગવો રે :૪।। : રિદ્ધ સમૃદ્ધિ
રળી અમજયા હો - તો સુખે દેવા
આપો તો - જપ તપ દાન સર્વે
પૂરા કરો રે :૫।। : તેતો સર્વે
ત્યાં લેખાશે - કર્મ ધર્મ પ્રમાણે
તો. મહી નિરાશે ત્યાં તો તે
અર્મ રે :૬।। : અઘોરીને આળસુ
ને દુકર જાણી ફળ દેતા તો. તેવી
ડુંગરાતો પાછા ફરી જાશે રે :૭।। :
દુઃખ દર્દ ને દલમાં દાખે દૂર
કર્યા તેના તો - ટોળાઈ જાશે

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n42/mode/1up

realpatidar.com

પણ તેને સૂઝે નહી જી:૯૫॥:
તે માટે બાર વચન કહે છે- એતો
મુનીવર ભાઈ તો- બાકરશાહ
સહીને સમરો એ સામે જી:૯૬॥:

૭૯- શ્રી સતગોર સહદેવ વાચા:

આગમવાણી: ઉટેણ મુનીવરો
ઉભરે વધાઈજી-૧॥- નકલંક પડશે
ને થાશે નવાઈજી-૨॥- નકલંક
નામનો પાર ના જાણોજી-૩॥-
કોઈને કલંક નહી સત્ય પરમાણો
જી-૪॥- એક ધર્મ બીજો ધર્મ
ના કહીએ જી-૫॥- એક હુકમ નર
નકલંકનો કહીએજી-૬॥- એક વહી
એક નામ ભણાવીજી-૭॥- ત્યારે
તો નકલંક નામ ભણાવોજી-૮॥-
હિંદુ તુર્કને તોબા તાણીજી-૯॥-
મારા મુનિવરને કીમ પુસાલીજી:

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n43/mode/1up

2025-01-13 Obtained in -Manuscript -Aathiya Satpanth -Dua Mantra (1262)

realpatidar.com

ખારા સમુદ્ર મીઠા થાશીજી - ૧૧॥ =
ઝેર ને વિખવાદ અધર્મના જાશીજી -
૧૨॥ - ત્યારે તો નકલંક નામ ભણ્યું
શેજી - ૧૩॥ - બારશે કાળીંગો ને
સુખ સહાયતા થાશીજી - ૧૪॥ - પીર
બાકરશાહના રાજ સ્થાશીજી - ૧૫॥

— — O — —

નોંધઃ- આ પુસ્તકમાં થયેલી ભૂલો
સુધારીને વાંચશો. અને ભૂલચૂક
માફ કરી અમારું ધ્યાન દોરશો.
અને પુસ્તકનો સદ્ ઉપયોગ કરશો.
આ પુસ્તક મેળવવા પોસ્ટ, ગ્રાહક,
તથા પ્રકાશકનો સંપર્ક સાધવો —
લિ. શુભેચ્છક.
શ્રી. વિઠ્ઠલભાઈ. પી. પટેલ.
બાકરઅલીની વાડી, મિરઝાપુર રોડ
અમદાવાદ - ૧.

ૐ શ્રીનકલંકી
ના રાજ્યકાળમેં
પા સવાપાંચ તોલા ચાંદીનુ કુંભાર બાકરશા
બાવાને ત્યાં સોનાનુ રુપાનુ કુંભ કરશે નરેન્દ્રને ભેંટ
આપ [illegible] દરીદ્રતા દુર કરશે પાપ પણ ચાલ્યા જશે
બાકરશા દાદા દયા કરશે દુઃખ દૂર કરશે

realpatidar.com

https://archive.org/details/bk1262/page/n44/mode/1up



realpatidar.com

realpatidar.com